

551325

Seat No. _____

**Master of Library &
Information Science Examination**
March / April – 2003
Information Science : Paper - III

Time : 3 Hours]

[Total Marks : 100

સૂચના : બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

૧ ડેટા, માહિતી અને જ્ઞાન વિષે વિસ્તૃતમાં સમજાવો.

અથવા

૧ સમાજમાં માહિતીની જરૂરિયાત અને માંગના સંદર્ભમાં માહિતી વિષે ચર્ચા કરો.

૨ પ્રી-કોઓર્ડિનેટ નિર્દેશીકરણ એટલે શું ? રોઈન-ઈન્ડેક્સિંગ પ્રક્રિયા સમજાવો અને તેની મર્યાદાઓ ઓળખાવો.

અથવા

૨ પોસ્ટ-કોઓર્ડિનેટ નિર્દેશીકરણ એટલે શું ? યુનિટર્મ-નિર્દેશીકરણ પ્રક્રિયા સમજાવો અને તેની મર્યાદાઓ ઓળખાવો.

૩ વૈશ્વિક માહિતી સેવાઓના સંયોજનના સંદર્ભમાં યુનિસિસ્ટ (UNISIST)ની ભૂમિકા અંગે ચર્ચા કરો.

અથવા

૩ માહિતી કેન્દ્રો દ્વારા અપાતી અનુવાદ સેવાની જરૂરિયાત અંગે ચર્ચા કરો. ભારતમાં કયા કયા રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો દ્વારા અનુવાદ સેવાઓ આપવામાં આવે છે તેના નામ આપો.

૪ સારસંક્ષીપ્તના પ્રકાર વિસ્તૃતમાં સમજાવો.

અથવા

૪ ઈન્ફલીબનેટ વિષે વિસ્તૃતમાં લખો.

૫ નીચેનામાંથી કોઈ પણ બે ઉપર નોંધ લખો :

(૧) નિસ્સાતનું માળખું

(૨) કાળગ્રસ્ત માહિતી

(૩) ક્વીક અને ક્વોક

(૪) રીકોલ અને પ્રીશીશન રેશીયો (માહિતીની પદ્ધતિમાં).

551325]

1

[Contd...

ENGLISH VERSION

Instruction : All questions carry **equal** marks.

1 Explain in detail Data, Information and Knowledge.

OR

1 Discuss about Information with reference to need and demand of information in society.

2 What is pre-coordinate indexing. Explain chain-indexing process and identify its limitations.

OR

2 What is post-coordinate indexing. Explain uniterm indexing process and identify its limitations.

3 Discuss role of UNISIST with reference to coordination of universal information services.

OR

3 Discuss about need of Translation service given by information centres. Give names of national information centres in India, which are giving translation services.

4 Explain in detail types of abstracts.

OR

4 Write in detail about INFLIBNET.

5 Write notes on any **two** of the following :

(1) Structure of NISSAT

(2) Obsolescence of Information

(3) KWIC and KWOC

(4) Recall and Precision Ratio in Information System.